

પ્રકરણ-૨ (નિયમ સંગ્રહ-૧)
સંગઠનની વિગતો, કાર્યો અને ફરજો

- ૨.૧ જાહેર તંત્ર ઉદ્દેશ/હેતુ:- અતિપછાત જાતિઓના સર્વાંગી વિકાસ માટે નિગમની રચના કરવામાં આવેલ છે.
- ૨.૨ જાહેર તંત્રનું મિશન/દુરંદેશીપણું (વિઝન) :- અનુ.જાતિ પૈકીની અતિપછાત જાતિઓના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે પગલાં ભરવા.
- ૨.૩ જાહેર તંત્રનો ટૂંકો ઈતિહાસ અને તેની રચનાનો સંદર્ભ :- ગુજરાત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૨૬/૬/૨૦૦૧ના ઠરાવ ક્રમાંક અવક /૧૦૮૮ /૨૨૦૧/જ થી અનુસૂચિત જાતિઓમાં સૌથી વધારે પછાત (૧) હાડી, (૨) નાડીયા, (૩) સેનવા (૪) તુરી, (૫) ગરો, (૬) વણકર સાધુ (૭) અનુ.જાતિના બાવા જેવી અતિપછાત જાતિના લોકો અન્ય જાતિઓની સરખામણીમાં ચોક્કસ પ્રગતિ કરી શકે અને તેમનો આર્થિક ઉત્કર્ષ થઈ શકે તે માટે "અતિપછાત જાતિ વિકાસ બોર્ડ" ની રચના કરેલ છે. સરકારશ્રીના તા.૧૫/૧૨/૨૦૦૪ના ઠરાવ ક્રમાંક:અપજ /૧૦૨૦૦૨ /૧૦૫૦/હ થી નક્કી કરેલ અતિપછાત જાતિઓની વિગત પ્રમાણે (૧) તુરી-બારોટ,(૨) તીરગર-તીરબંદા, (૩) થોરી (૪) માતંગ વિ. જાતિઓનો ઉમેરો થયેલ છે. સરકારશ્રીના તા.૪/૧૨/૦૮ના ઠરાવ ક્રમાંક/અવક /૧૦૮૮/૨૨૦૧/જ થી સફાઈ કામદારો અને તેમના આશ્રિત સિવાયના વાલ્મિકી જાતિને ખાતાની યોજનાઓમાં લાભ આપવા ઠરાવેલ છે. આમ અતિપછાત બોર્ડમાં ૧૨ (બાર) જાતિઓનો સમાવેશ થયેલ છે.
- ૨.૪ જાહેર તંત્રની ફરજો:-
- ૨.૫ જાહેર તંત્રની મુખ્ય પ્રવૃત્તિઓ /કાર્યો :-
- ૨.૬ જાહેર તંત્ર ધ્વારા આપવામાં ઉપર મુજબ ૨.૪, ૨.૫, ૨.૬, નું સંક્ષિપ્ત વિવરણ

આવતી સેવાઓની યાદી અને નીચે મુજબ છે.

તેનું સંક્ષિપ્ત વિવરણ:-

૧. આ બોર્ડનો ઉદ્દેશ રાજ્ય સરકાર તથા અનુ.જાતિ વિકાસ નિગમ અને નિયામકશ્રી, અનુ.જાતિ કલ્યાણ ખાતાના સંપર્કમાં રહીને અતિપછાત જાતિના લોકોના આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક વિકાસ માટે કાર્યવાહી કરવાની રહેશે.
૨. આ જાતિના લોકોના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક વિકાસ માટે પગલાં સૂચવવાના રહેશે.
૩. અનુસૂચિત જાતિઓ માટેના વિકાસ માટેની યોજનાઓના મૂળભૂત આશય સાથે સુસંગત રહી અતિપછાત જાતિઓ માટે આ યોજનાઓના અસરકારક અમલ માટે જરૂરી સલાહ સૂચન કરશે.
૪. અતિપછાત જાતિઓના આર્થિક વિકાસ અંગે આર્થિક ઉપાર્જન થાય તેવી યોજનાઓ અને તે અંગેની તાલીમ અંગે સલાહ આપશે.
૫. સરકાર તરફથી ઉપરોક્ત હેતુઓ માટે સોંપવામાં આવે તે અન્ય કામગીરી આ બોર્ડ ધ્વારા કરવાની રહેશે.

આ બોર્ડ ડી.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)ની છત્રછાયામાં અને તેના સંપર્કમાં રહી કામગીરી કરશે, તેમજ જરૂર જણાયે નિયામકશ્રી, અનુ.જાતિ કલ્યાણ ખાતાની કચેરીઓની સહાય લઈ કામગીરી કરશે.

- ૨.૭ જાહેર તંત્રના રાજ્ય,નિયામક ડી.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ), કચેરી, પ્રદેશ જિલ્લો, બ્લોક બ્લોક નં. ૨, ડી-૨ વિંગ, ચોથો માળ, કર્મચોગી વગેરે સ્તરોએ સંસ્થાગત ભવન ગાંધીનગર માળખાનો આવેખ (જ્યાં લાગુ પડતું હોય ત્યાં) :-

- ૨.૮ જાહેર તંત્રની અસરકારતા અને

કાર્યક્ષમતા વધારવા માટેની લોકો
પાસેથી અપેક્ષાઓ

૨.૯ લોક સહયોગ મેળવવા માટેની
ગોઠવણ અને પધ્ધતિઓ :-

૨.૧૦ સેવા આપવાના દેખરેખ કચેરી અધિક્ષક, જી.કલાર્ક.
નિયંત્રણ અને જાહેર ફરીયાદ
નિવારણ માટે ઉપલબ્ધ તંત્ર

૨.૧૧ મુખ્ય કચેરી અને જુદાજુદા ડી.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ),
સ્તરોએ આવેલી અન્ય બ્લોક નં. ૨, ડી-૨ વિંગ, ચોથો માળ, કર્મયોગી
કચેરીઓમાં સરનામાં ભવન ગાંધીનગર
(વપરાશકારને સમજવામાં સરળ
પડે તે માટે જિલ્લા વાર
વર્ગીકરણ કરો)

યોજનાકીય લાભો અંગે સંબંધિત જિલ્લાના (૧) જિલ્લા પછાતવર્ગ કલ્યાણ
અધિકારીશ્રી(વર્ગ-૧) (૨) જિલ્લા સમાજકલ્યાણ અધિકારીશ્રી,(પંચાયત) (૩) જિલ્લા મેનેજરશ્રી,
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ (૪) તાલુકાના સમાજકલ્યાણ નિરીક્ષકશ્રીનો સંપર્ક સાધવાનો
રહેશે.

૨.૧૨ કચેરી શરૂ થવાનો સમય :- સવારે ૧૦.૩૦ કલાકે

કચેરી બંધ થવાનો સમય :- સાંજે ૧૮.૧૦ કલાકે